

ગાંધીનગરના અપક્ષ ઉમેદવાર રાહુલ ચીમનભાઈ મહેતા



ઉમર : ૪૦ વર્ષ , બી ટેક, કોમ્પ્યુટર સાઈસ, આઈ આઈ ટી, દિલ્લી,
એમ એસ, કોમ્પ્યુટર સાઈસ , રટગર્સ યુનિવર્સિટી, ન્યુ જર્સી, USA

૧૭

રાહુલ ચીમનભાઈ મહેતા
(અપક્ષ)



BATTERY TORCH
હાથ બત્તી

અમેરીકાની પોલીસ, અદાલતોમાં ભ્રષ્ટાચાર કેમ ઓછો છે?
એકમાત્ર કારણ - ત્યાં નાગરીકો પાસે પોલીસ ચીફ, ન્યાયાધીશોને બદલવાની સત્તા છે

ભારતમાં ભ્રષ્ટાચાર વધારે છે. અમુક 'પ્રખર' બુદ્ધીજીવીઓ કારણ આપે છે કે ભારતીયોનાં સંસ્કારો (પોલીટિકલ કલ્ચર)માં ભ્રષ્ટાચાર છે. આ પોલીટિકલ કલ્ચરવાળા 'પ્રખર' બુદ્ધીજીવીઓ ખોટા છે. ભારતમાં ભ્રષ્ટાચાર વધારે છે, અને તેનું એકમાત્ર કારણ છે - અહિંયા રાઈટ ટુ રિકોલ નથી. રાઈટ ટુ રિકોલ એટલે :

૧. નાગરીકો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, તમામ ન્યાયાધીશો, પોલીસ ચીફ, શિક્ષણ અધિકારી, રિઝર્વ બેંક ગવર્નરને સીધા જ બદલી શકે (વર્ષો રાહ જોયા વિના), તેવા કાયદાઓ.
૨. નાગરીકો અધિકારીની બદલી અટકવી પણ શકે, જેથી અધિકારીઓ મંત્રીના દબાણ વિના કામ કરી શકે.
રિકોલની વ્યવસ્થા અમેરીકામાં સ્થાનિક, રાજ્ય સ્તરે ૧૮૦૦માં થઈ. ત્યાં નાગરીકો પાસે પોલીસ ચીફ, ન્યાયાધીશ, સરકારી વકીલ, મુખ્યમંત્રી બદલવાની પ્રોસીજર છે. ભારતની અનેક સમસ્યાઓનું મુળ છે: નાગરીકો નેતા, અધિકારી, ન્યાયાધીશોને નથી બદલી શકતા. ગરજ સરી કે વેરી. ચુંટણી પતે કે તરત જ કેમ મંત્રી નાગરીકોનો દુશ્મન અને પૈસાદારોનો મિત્ર બને છે? કેમકે નાગરીકો પાસે તેને બદલવાની સત્તા નથી. અન્ય દાખલાઓ લો : (૧)૨૦૦૮માં અમરનાથ મંદીરને આપેલ જમીન જુટવાની મજાલ કેમ કરી? કેમકે ભારતનાં નાગરીકો પાસે પ્રધાનમંત્રીને કાઢી મુકવાની પ્રોસીજર નથી (૨) આશારામનાં આશ્રમના બે બાળકોની હત્યામાં થઈ. કેમ પોલીસે ભીનું સંકેત્યું? કેમકે નાગરીકો પાસે પોલિસ કમિશનરની બદલી અટકાવાની સત્તા નથી (૩) જિન્હાના વખાણ કરવાની મજાલ કેમ થઈ? કેમકે નાગરીકો પાસે સાંસદ બદલવાની સત્તા નથી. (૪) નર્મદામા વિલંબ કેમ થયો? કેમકે નાગરીકો પાસે ન્યાયાધીશો બદલવાની સત્તા નથી.

અનેક ઉમેદવારો પાસે મોટા ફોટાઓ આપવાનાં પૈસા છે. રોડ શોમાં એકટરો બોલાવવા પૈસા છે. પણ તેમને રિકોલ વિષે નાગરીકોને માહિતી આપતી જાહેરખબર નથી આપવી. હું એકમાત્ર ઉમેદવાર છું, જેણે નાગરીકો પ્રધાનમંત્રી, પોલિસ ચીફ, ન્યાયાધીશો બદલી શકે તેવી પ્રોસીજરોનો લખાણ આપ્યા છે અને તેનો પ્રચાર કર્યો છે - જેથી હું હારું કે જીતું, આ કાયદાઓ વિષે માહિતી નાગરીકો પાસે પહોંચે. મારું એક કામ કરો - આપ તમામ ઉમેદવારોને પુછો કે તેઓ રિકોલના ટેકેદાર છે કે વિરોધી? અલબત્ત, પુછવું શું? ૧૯૭૭મા જનતા પાર્ટીના જે ઘોષણાપત્રથી વાજપાઈ, અડવાણી મંત્રી થયા તેમાં રિકોલની ખાત્રી હતી. ૩૦ વર્ષોમાં તેમણે અમલ કર્યો? અન્ય મોટા અપક્ષ ઉમેદવારો જે રિકોલ (એટલે નાગરીકો મંત્રી, ન્યાયાધીશો બદલી શકે)નાં ટેકેદાર હોત, તો તેમને જાહેરખબર આપતા કોણે રોક્યા? આવા રાઈટ ટુ રિકોલનાં વિરોધીઓને વોટ આપવો તે પાંચ વર્ષની ગુલામી માંગવા સમાન છે. રિકોલ ભ્રષ્ટાચાર ઘટાડવાનો એકમાત્ર ઉપાય છે. એટલે રિકોલનો વિરોધ તે ભ્રષ્ટાચારને ટેકો છે. જે આપ રિકોલ વિરોધીને વોટ આપશો, તો આપને પાંચ વર્ષની ગુલામી માત્ર મળશે. તમારો મત તમારું જ નુકશાન કરશે. આપ રિકોલનાં ટેકેદારને મત આપશો, તો મોટી પાર્ટીઓનાં વોટ તુટશે, અને તોજ મોટી પાર્ટીઓને રિકોલનાં કાયદા પસાર કરવાની ફરજ પડશે. જે રિકોલ વિરોધી ઉમેદવારને વોટ આપશો, તો બુદ્ધીજીવીઓ કહશે - નાગરીકોને રિકોલનો કાયદો નથી જોઈતો. શું આપ ઇચ્છો કે રિકોલની માંગણી નબળી પડે? રિકોલની માંગણીને પાર્ટીઓના ઉંઘતા નેતાઓ સુધી પહોંચાડવીની આજે મહાન તક છે - આ તકનો પુરો ઉપયોગ કરો. રાઈટ ટુ રિકોલનાં પ્રચાર કરતા ઉમેદવારને મત આપો અને પાર્ટીઓના મત તોડો તોજ તેઓ જાગશે. અમારી અન્ય માંગણીઓ છે :

૧. **MRCM** : ખનીજોની રોયાલ્ટી, સરકારી જમીનનું ભાડુ સીધું જ નાગરીકો, સેનાને મળે, તેવો કાયદો બનાવવો. દા.ત. માનો ખનિજ રોયાલ્ટી, સરકારી જમીનનું ભાડુ જાન્યુ-૨૦૦૮માં રૂ ૪૫૦૦૦ કરોડ આવ્યું. તો રૂ ૧૫૦૦૦ કરોડ સેનાને અને આશરે રૂ ૩૦૦ દરેક નાગરીકના પોસ્ટ, બેંક ખાતામાં આપવા. આથી સૈન્ય શક્તિ વધશે, ત્રાસવાદ ઘટશે, ગરીબી ઘટશે. અનાજ, કઠોળ, દવાઓનાં ભાવ અનેક ગણા થયા છે, ગરીબોની આવક એટલી વધી નથી. આથી ગરીબી વધી. જે ગરીબી નહીં ઘટે, તો ગરીબ હિન્દુઓ ખ્રિસ્તી અથવા નકસલવાદી થશે. હિન્દુ ધર્મ ઘટશે. આથી સાચા હિન્દુવાદીઓને વિનંતી કે તેઓ સરકારી જમીનનું ભાડુ નાગરીકોને આપવાના કાયદાને ટેકો આપે, જેથી ગરીબ હિન્દુઓ ખ્રિસ્તી અથવા નકસલવાદી ન બને.

૨. નાગરીક કલેક્ટરની કચેરીએ ભ્રષ્ટાચાર વિરોધી એફીડેવીટ આપેતો તેને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના વેબસાઈટ પર મુકવી. નાગરીકોને આ એફીડેવીટો પર રૂ ૩ આપી હા-ના નોંધાવા દેવી. નાગરીકોની હા-ના ને પણ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના વેબસાઈટ પર મુકવી. આથી નાગરીકોનો આવાજ તમામ સ્તરે ઝડપથી પહોંચશે.

૩. ગરીબ પછાતોના ટેકાથી રિઝર્વેશન ઘટાડવું : પછાતોને ચોઈસ આપવી- તેને વાર્ષિક રૂ ૬૦૦ જોઈએ છે કે રિઝર્વેશન? ૮૦% ટકા પછાતો આઈક સહાય લેશે - તેમને રિઝર્વેશનમાં કોઈ લાભ નથી. આમ રિઝર્વેશન ૫૦%થી ઘટી ૫% થશે.

૪. ૪૯૮(ક) કલમ રદ કરવી. આમા માત્ર વકીલો કમાણા છે અને અનેક નિર્દોષ જેલમાં સબડ્યા છે.

અન્ય ૭૦ કાયદાઓની વિગત <http://rahulmehta.com> પર આપેલ છે.

સંપર્ક : એફ-૧/એ, સુપથ-૨, જુનાવાડજ બસસ્ટેન્ડ, ૮૮૨૫૧-૨૭૭૮૦, MehtaRahulC@yahoo.com

આ એડ જાહેરમાં વાંચવી, રાઉટ ટૂ રિકોલનો પ્રચાર કરવો. ઝેરોક્ષ સહુને આપવી.